


## બોટાદ જિલ્લો



- ❖ બોટાદ જિલ્લો ઉત્તરે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લો, પૂર્વમાં ભાવનગર જિલ્લો પશ્ચિમમાં રાજકોટ જિલ્લો અને દક્ષિણમાં અમરેલી જિલ્લાની સરહદો આવેલી છે.
- ❖ બોટાદ જિલ્લો ભાવનગર અને અમદાવાદ જિલ્લા અમુક તાલુકાને છુટા પાડીને નવા બોટાદ જિલ્લાના રચના કરવામાં આવી છે.
- ❖ ક્ષેત્રફળ :- ૨,૫૬૪ ચો.કિમી.
- ❖ સ્થાપના :- ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ (ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયગાળામાં)
- ❖ વિધાનસભાની કુલ સીટો :- બોટાદ, ગઢડા (એસ.સી)
- ❖ વસ્તી :- ૬,૫૨,૦૦૦ (વર્ષ-૨૦૧૧)
- ❖ સાક્ષરતા :- ૬૭.૬૩% (વર્ષ-૨૦૧૧)
- ❖ તાલુકાઓ :- ૪ (બોટાદ, ગઢડા, ભરવાળા અને રાણપુર)
- ❖ તાલુકા પંચાયતની કુલ સીટો :- ૪ (બેઠકો-૭૮) (બોટાદ-૨૨, ગઢડા-૧૮, ભરવાળા-૧૬ અને રાણપુર-૧૮)
- ❖ વિવિધ વિષય ની માહિતી અને રેગ્યુલર ફ્રી ટેસ્ટ, કરંટ અફેર્સ વગેરે માટે આજે જ ડાઉનલોડ કરો Gnan Bhandar મોબાઇલ એપ્લિકેશન
- ❖ જિલ્લા પંચાયતની કુલ સીટો :- ૨૦
- ❖ નગરપાલિકાની સંખ્યા અને વોર્ડ :- ૧ બોટાદ-૧૧ (૪૪)
- ❖ ગામડાંઓ :- ૧૮૦ (બોટાદ(૫૨), ગઢડા (૭૫), ભરવાળા(૨૮) અને રાણપુર(૩૪))
- ❖ ગ્રામ પંચાયત :- ૧૮૦
- ❖ પીનકોડ નં :- ૩૬૪૭૧૦
- ❖ મુખ્ય મથક :- બોટાદ
- ❖ આરટીઓ નંબર :- GJ-33
- ❖ લિંગ પ્રમાણ :- ૮૨૨
- ❖ વસ્તીગીચતા :- ૨૫૦
- ❖ નદીઓ :- ઘેલો, કાળુભારકેરી, ગોમા, સુખભાદર, નિલકા, ઉતાવળી
- ❖ કિલ્લો :- રાણાજી ગોહિલનો કિલ્લો (રાણપુર)

- ❖ મુખ્ય પાકો :- મગફળી, કપાસ, શાકભાજી, ડાંગર, બાજરી, જુવાર અને ડુંગળી
- ❖ ઝેમ :- ખાંભડા ઝેમ (ઉતાવળી નદી), ભાડલા ઝેમ (સુખભાદર), કાળુભાર ઝેમ (કાળુભાર નદી)
- ❖ ઉદ્યોગો :- ડાયમંડ અને સિમેન્ટ ઉદ્યોગ
- ❖ ખનીજ :- કેલ્સાઈટ
- ❖ તળાવ :- કૃષ્ણસાગર તળાવ
- ❖ ડેરી :- સુગમ ડેરી, મધુસૂદન ડેરી
- ❖ રાષ્ટ્રીય રાજમાર્ગ :- રાષ્ટ્રીય રાજમાર્ગ નં- 8 (A) (નવો નંબર-47)
- ❖ જોવાલાયક સ્થળો :- અક્ષરપુરસોત્તમ મંદિર (સાળંગપુર), સ્વામીનારાયણ મંદિર (ગઢડા) પાળીયાદ, સંત રોહિદાર મંદિર (નાના ભડલા), ભીમનાથ મહાદેવ મંદિર (ભીમનાથ), લાખણુકા મોક્ષ મંદિર, જડેશ્વર મહાદેવ દાદા મંદિર અને કપિલેશ્વર મહાદેવ મંદિર (રાણપુર)

### વિશેષ નોંધ :-

- ➔ ઉતાવળી નદીને કિનારે આવેલું બોટાદ સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર તરીકે ઓળખાય છે. અને 'ગેટવે ઓફ કાઠીયાવાડ' ગણાય છે.
- ➔ ઘેલો નદીને કિનારે આવેલું ગઢડા ખાતે શ્રી સહજાનંદ સ્વામીએ ઉપદેશકથાઓ કહેલી અને તેમનો અનુયાયી દાદા ખાચર હતો. સહજાનંદ સ્વામીનું મૂળ નામ ઘનશ્યામ મહારાજ હતું.
- ➔ બોટાદ શહેર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે.
- ➔ બરવાળા તાલુકામાં આવેલ સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર આવેલું છે જેની સ્થાપના ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. આ સ્થળે ભૂતપ્રેત ભગાડવાની વિધિ થતી હોય છે.
- ➔ બોટાદ જિલ્લો ઉદ્યોગ માટે જાણીતો છે.
- ➔ બોટાદ જિલ્લો કાઠીયાવાડ, ઝાલાવાડ અને ગોહિલવાદ પ્રદેશને જોડતો જિલ્લો છે.
- ➔ બોટાદ જિલ્લાના સરવા ગામેથી કેલ્સાઈડ મળી આવે છે.
- ➔ બોટાદ જિલ્લો જમફળની ખેતીમાં ગુજરાતમાં ત્રીજું સ્થાન ધરાવે છે.
- ➔ બોટાદ જિલ્લાના પાળીયાદ ખાતે પૂજ્ય સંતશ્રી વિસામણ બાપુની જગ્યા આવેલી છે.
- ➔ બોટાદમાં દામોદરદાસ ખુશાવદાસ બોટાદકર કોલેજ આવેલી છે.
- ➔ બોટાદ જિલ્લાનું સુખભાદર નદીને કિનારે આવેલું રાણપુર ઇ.સ. ૧૩૧૦માં રાણાજી ગોહિલે વસાવ્યું હતું.
- ➔ રાણપુર તાલુકાનું 'વેજલકા' સિંધૂ સંસ્કૃતિની ઐતિહાસિક સ્થળ આવેલું છે.
- ➔ વિવિધ વિષય ની માહિતી અને રેગ્યુલર ફ્રી ટેસ્ટ, કરંટ અફેર્સ વગેરે માટે આજે જ ડાઉનલોડ કરો Gnan Bhandar મોબાઈલ એપ્લીકેશન
- ➔ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રનું સૌપ્રથમ ન્યૂઝ પેપર 'ફૂલછાબ' રાણપુર ખાતેથી કરી હતી.
- ➔ બરવાળા તાલુકામાં નિલકા નદીને કિનારે આવેલું સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે.
- ➔ ગુજરાતમાં નુતન ગ્રામ વિદ્યાપીઠ અને જે.પી. કુમારખા ગ્રામ વિદ્યાપીઠ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલ છે.
- ➔ ગોમિનાથજી મંદિર તરીકે ઓળખાતું શ્રી સ્વામિનારાયણ મંદિર ગઢડામાં આવેલું છે. સ્વામિનારાયણે ૯ ઓક્ટોબર ૧૮૨૮ના રોજ આ મંદિરમાં મૂર્તિઓની સ્થાપના કરી હતી.